



WIRES & CABLES

AN ISO 9001:2015 CERTIFIED COMPANY

JIGAR CABLES LIMITED

Registered & Corporate Office

Plot No. 164/14 & 15, Jamwadi GIDC - 2

Gondal - 360 311 Dist. Rajkot (Gujarat) INDIA

Tel : +91 2825 221422

Web : www.sigmacab.com

E-mail : info@sigmacab.com

CIN No. : L28999GJ2017PLC095651

December 08, 2020

To
BSE Limited (SME Platform)
P. J. Towers,
Dalal Street,
Mumbai – 400 001.

Dear Sir,

Sub: Publication of Advertisement of Notice of Extra-Ordinary General Meeting and E-voting in Newspaper by Company

Ref: Scrip Code: 540651 Security ID: JIGAR

Respected Sir/Madam,

Pursuant to Regulation 42 of SEBI (Listing of Obligations and Disclosure Requirements) Regulation, 2015, we enclosed herewith News Paper advertisement of Extra-Ordinary General Meeting to be held on Saturday, January 02, 2021, at 04:00 P.M. and information of E-voting was duly published in following newspaper:

THE ECONOMIC TIMES [English Newspaper] dated December 08, 2020

THE NAVGUJARAT SAMAY [Gujarati Newspaper] dated December 08, 2020


The copy of advertisement published is enclosed for your reference.

Kindly consider the same and take on record.

Thanking You.

For, JIGAR CABLES LIMITED

Priyanka Marvania



CS Priyanka K. Marvania
Compliance Officer & Company Secretary
Membership No.: A58477

Encl: a/a





08/12/2020 THE ECONOMIC TIMES - AHMEDABAD

Printed and Published by: M. S. Prasad, at the office of the printer, at No. 12, 27th Floor, Tower Towers Premises Co-op. Society Ltd., Vast Sarvarkar Marg, Prabhadevi, Mumbai - 400 025.

Registered Office: Plot No. 16A/14 & 15, Janmardi, G.D.C. Gendal, Rajkot - 360 331, GUJARAT (INDIA)

THE ECONOMIC TIMES | AHMEDABAD | TUESDAY | 8 DECEMBER 2020 | WWW.ECONOMICTIMES.COM

Taxman Probes if Startups Structures Violate Norms

Cos taking holding outside to attract foreign investment, say insiders

Sachin.Dave@timesgroup.com

Mumbai: Several Indian startups that flipped their structures to hold their assets, share holding, and in some cases even, intellectual property outside India are set to face some heat from the income tax department, said two people with direct knowledge of the matter.

Multiple startups, in the last few years have created foreign companies and holding their Indian businesses through them.

The income tax department is investigating whether flipping structures could lead to any transfer pricing violations.

The tax department is looking to scrutinise several start-ups to see if these new structures violate transfer pricing regulations.

In most cases after the structures are flipped, Indian entities operate like



ANIRBAN BORJA

agents or intermediaries and pay tax on part of the way.

"Cost plus model is fine for a multinational that has an Indian entity and only does some outsourcing work. But how does a start-up whose whole business is India go

the same way," said a senior government official.

This comes at a time when Naukri.com's Sanjeev Bikhchandani took to Twitter to complain about the problem of flipping structures.

Economy: Macro, Micro & More

9

Withdrawal of New Agri Laws Unlikely: Officials

Ritural Tiwari & Jayashree Bhosale

New Delhi/Pune: The government expects tough negotiations with farmers as it is unlikely to accept the demand of withdrawing the new laws when the two sides meet for the sixth round of negotiation on Wednesday, officials said.

"Farmers are demanding repealing of laws, which doesn't look possible. There is little room for improvisation in laws. We have discussed each and every provision in detail. The government may propose for legal intervention over disputes, which as per the current law have to be resolved in courts of sub division magistrates and district magistrates," said a senior agriculture ministry official.

He said the government remained committed to the minimum support price (MSP) mechanism. "The government purchases 40-45% of the total production of wheat and rice at MSP to feed two-third of population under National Food Security Act. So, government purchase is bound to continue to fulfil this political obligation. No government can take risk to discontinue schemes that guarantee income for farmers," he said.

The official said that fear of MSP scrapping is baseless as government transfers more than Rs 2 lakh crore annually to farmers' bank accounts towards procurement of grain, oilseeds and pulses besides giving Rs 75,000 crore to farmers under PM KISAN scheme. "Apart from that, government spends more than Rs 1 lakh crore for subsidised fertiliser seeds and irrigation facilities. We are committed towards farmers welfare," he said. The official said that the procurement of rice so far has gone up by 20%



from last year, indicating government's commitment towards continuing MSP.

Farm leaders however are adamant and are getting support from traders in many states. In Maharashtra, about 300 wholesale markets will remain closed for the Bharat Band called on Tuesday. Most mandis are controlled by the Nationalist Congress Party (NCP), part of the Shiv Sena-led coalition in Maharashtra. A handful are controlled by the Congress or the BJP.

Dhili Mohite Patil, NCP leader and president of Maharashtra State Market Committee Cooperative Union, an association of 306 APMCs, said "Farmers are not protesting for the benefit of farmers."

Deadline Extended for LIC Actuarial Firm Bidding

Our Bureau

New Delhi: The government has extended the deadline for submission of bids from eligible companies for the appointment of an actuarial firm to determine the embedded value of Life Insurance Corporation of India, till December 11.

Taking a step towards the public listing of the country's largest public insurer, the Department of Investment and Public Asset Management had floated an invitation for proposals (RFP) last month. Last date for applications was earlier set at December 8.

LIC needs to develop an Indian Embedded Value (IEV) reporting framework for the necessary disclosures in the proposed initial public offering. As per conditions specified, interested bidders should have developed and reported actuarial EV or IEV of a life insurance company of Rs 10,000 crore or \$1.3 billion or more between April 1, 2015, and March 31, 2020.

NHAI for Private Placement of InvIT

Nishtha.Saluja@timesgroup.com

New Delhi: National Highways Authority of India has set the ball rolling for private placement of its proposed infrastructure investment trust (InvIT) to fund highway projects and will soon appoint an international legal counsel as part of the exercise. "This is part of the process of launching the InvIT," a senior official at NHAI told ET. "We are expecting the InvIT to gather pace in the last quarter of the current fiscal year as markets improve," NHAI, responsible for development of highways in the country is in the process of setting up an InvIT—the first of its type sponsored by a government entity in the country—to raise funds for its projects. An InvIT is a collective investment vehicle similar to mutual funds and registered with market regulator Sebi—that enables individuals and institutions to directly invest small amounts in infrastructure projects and earn a small portion of income in return. It is seen as a key instrument for big infrastructure companies to raise capital using their operating assets and help the country meet its huge infrastructure funding requirements.

NHAI will bundle its highway projects to form a special purpose vehicle (SPV) to be offered to investors under InvIT. The SPV would then be traded on the stock exchanges, and returns will be linked to the InvIT's performance in the capital market. InvIT as an instrument provides greater flexibility to investors and is expected to create specialised operators and maintenance concessionaires, attract patient capital for around 10 years to the highways market.

NHAI has been actively working on setting up an InvIT to monetise its complete and operational national highways projects with the objective of mobilising additional resources through capital markets. Union highway minister Nitin Gadkari told ET on Monday that the government was actively exploring new modes of raising finances outside of the government budget, including InvIT, to fund its highway construction plan over the next four years.

"We have come up with better instruments than roll-over transfer, and I am hopeful we will achieve success in these models," Gadkari said. The highway ministry has gone slow on monetising its road assets through TOT amid the slowdown caused by the outbreak of Covid-19.

'Women Hold 17% of Board Positions at India Inc Now'

Saumya.Bhattacharya@timesgroup.com

New Delhi: India Inc boardrooms are gradually getting more inclusive. Between 2012 and 2020, India has seen an 8.6% increase in the number of women on boards, with women holding 17% of board positions in 2020, according to the Egon Zehnder Global Board Diversity Tracker 2020.

All large company boards in the 2020 report include at least one woman. In India, that number is higher, with 96% of the companies in the survey having at least one woman on their board. This is largely because India requires public companies to have at least one woman director on board.

India fared better than Asia in diversity of both executive and non-executive chair roles, with 5% of executive chairs and 10% of non-executive chair roles respectively filled by women in India. Those numbers stand at 2.6% and 5%, respectively, in Asia as a whole.

"There is progress in gender diversity on the boards, but the job is still not done," said Palavi Kathuria, managing partner at Egon Zehnder. "The ideal percentage of women on boards should aim for will be at least 25%." Also, the narrative needs to shift from counting the numbers to making the numbers count.

This year's report analysed data from 1,605 companies across 44 countries with a combined market capitalisation of more than \$48 trillion. Forty-eight companies from India were included in the survey.

As new faces in the boardroom, women in India comprised 16.3% of new board appointments in 2020.

PRINTED AND PUBLISHED FOR THE PROPRIETORS, BENECKE COLLEMAN & CO. LTD., 12, 27th Floor, Tower Towers Premises Co-op. Society Ltd., Vast Sarvarkar Marg, Prabhadevi, Mumbai - 400 025. Registered Office: Plot No. 16A/14 & 15, Janmardi, G.D.C. Gendal, Rajkot - 360 331, GUJARAT (INDIA)

E-AUCTION NOTICE

Air India through MSTC invites E-auction bids for Sale of its properties located across India as per the details given below:

Sl. No.	Location	Description
1.	BHUJ	Residential Plot No. 21, area 231 sqm. approx. Ghanshyam Nagar
2.	BENGALURU	Residential Plot No. 3, area 5934.74 sqm. approx., KHB Layout, Gangamuhall Village, Devanahalli Taluk
3.	CHENNAI	3 BHK Flat No.31/1, Dr. M.G.R. Road, Kalakshetra Colony, Besant Nagar
4.	GWALIOR	Land and Bldg. at 28/607, Maharani Laxmi Bai Road
5.	KOLKATA	Residential Plot, area 2.64 acre Approx. at Mondai Ganthi, Kaikhai
6.	LONAVALA	08 Units of 2 BHK Flat at Sohini Apts., 19/2A - 1 Udal Shankar Sarani, Golf Greens
7.	MANGALURU	Air India Holiday Home, Plot No.26, Village Tungarli (Near Khandali), plot area - 2384 sqm. approx.
8.	MUMBAI	3 BHK Flat No. 102, 1st Floor in Diana Block alongwith the Car Shed 'D', Hoisela - Diana Complex, Kadri
9.	MUMBAI	2 BHK Flat No. S1, 2nd Floor, Madhuvan Apartments, Kadri - Kambla Road, Kadri
10.	MUMBAI	Residential plot (area-2006 sqm. approx.) with 14 flats of built up area 2030 sqm. approx. at Pali Hill, Bandra (W)
11.	MUMBAI	1 Unit of 3BHK Flat & 2 Units of 2 BHK Flats, Sachin Da Strains, Gazdar scheme, Santacruz (W)
12.	MUMBAI	1 combined Unit (Flat No.15 & 16), Cozihome CHS Ltd., Pali Hill Road, Bandra (W)
13.	MUMBAI	Flat No. B-274, 27th Floor, Twin Towers Premises Co-op. Society Ltd., Vast Sarvarkar Marg, Prabhadevi
14.	NASHIK	06 Units of CIDCO 2BHK Flats, Bldg.No.35, Swami Vivekanand Nagar

The Bid starting date is 07/01/2021 and closing date is 08/01/2021 for all the above properties.

E-auction Notice is displayed on website: www.airindia.in

For participation in the E-auction, Registration and Pre-Bid EMD submission with MSTC is required.

Details of Reserve Price, Pre-Bid EMD etc. given on M/s. MSTC, the E-auctioneer website: www.mstcecommerce.com

Cushman & Wakefield India Ltd. (The Realty Consultant of Air India Ltd.)

City	Name	Contact
Gwalior	Karan/Ashish	+91 95400 50101 / +91 8800681212
Bengaluru/Mangaluru	Anith/Ashish	+91 8822229971 / +91 8669646323
Chennai	Tarinius S	+91 9952626252
Kolkata	Arjit Acharya	+91 8100329886
Mumbai	Akshay/Adwait	+91 8251640193 / +91 8251648893

SIGMA WIRE & CABLES

JIGAR CABLES LIMITED

Registered Office: Plot No.16A/14 & 15, Janmardi, G.D.C. Gendal, Rajkot - 360 331, GUJARAT (INDIA)

CIN: L28990GJ2017PLC09565 Web : www.sigmacab.com Ph. +91-2825-224242 Email : info@sigmacab.com

Notice for Extra-Ordinary General Meeting and E-voting

NOTICE is hereby given that the Extra-Ordinary General Meeting (EGM) of Jigar Cables Limited will be held on Saturday, January 02, 2021 at 04:00 PM through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) in compliance with General Circular in compliance with Companies Act, 2013, General Circular No. 14/2020, 17/2020 and 20/2020 issued by the Ministry of Corporate Affairs (MCA) and Securities and Board of India without physical presence of the members at a common venue to transact the business as set out in the notice approved in Board Meeting dated December 03, 2020 convening EGM.

The Notice of EGM has been sent by email to all those members of the Company whose email ids are registered with the Depository Participants.

The notice of EGM is also available on the website of Company www.sigmacab.com, website of Bombay Stock Exchange at www.bseindia.com & National Securities Depositories Limited (NSDL) at www.evoting.nsdl.com

Log in credential has already been sent to those members whose email id is registered with the DP/Company by an email. Members who have not registered/updated their email id are requested to register the same by an email to cs@sigmacab.com by providing DP/Client ID, Name, PAN, Mobile and Email id. Members who have not registered their email addresses will be able to cast their vote through remote e-voting or through the e-voting system during the meeting as provided in the notice of EGM. The instructions for joining and voting shall be provided in the Notice of EGM which can be accessed at the above mentioned websites.

In terms of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the SEBI Regulation, the Company is providing the facility to its members to exercise their right to vote by electronic means on any or all the businesses specified in the notice convening the EGM of the Company (remote e-voting), through e-voting system provided by NSDL. The details pursuant to the Act are as under:-

a) Members holding shares as on the Cut-off date, i.e. December 25, 2020 (eligible members), to exercise their right to vote by remote e-voting and voting to be held at EGM on any or all of the businesses specified in the Notice convening the EGM.

b) The remote e-voting will commence on December 29, 2020 at 09:00 AM, and ends on January 01, 2021 at 05:00 PM, and the remote e-voting module shall be disabled for voting thereafter and voting through electronic means shall not be allowed thereafter. Once the voting module resolution is cast by the member the member shall not be allowed to change it subsequently. Eligible members may participate in the EGM even after exercising his right to vote through remote e-voting but shall not vote again in the EGM. Only the eligible members shall be entitled to avail the facility of remote e-voting at the EGM.

c) In case a person has become the member of the Company after the dispatch of EGM Notice but on or before the cut-off date i.e. December 25, 2020, may write to CS, Priyanka Marwaha (Company Secretary) at email ID: cs@sigmacab.com for obtaining the credentials for remote e-voting.

In case you have any queries or issues regarding e-voting, you may write email to evoting@nsdl.com or cs@sigmacab.com. Further the documents are available for inspection in electronic mode only by an email at cs@sigmacab.com.

Date: December 08, 2020
Place: Gondal (Rajkot)

Sd/- Vijay G. Shingala Chairman and Managing Director

MIZORAM UNIVERSITY

AIZAWL, MIZORAM - 796 004

No.1-IESt.107/247 Dated Aizawl, the 4th December, 2020

Online applications are invited for filling up of Principal, Pechungma University College in Mizoram University (Central University). The detailed advertisement and link to the online portal for applying the post is available in the Mizoram University website www.mzu.edu.in. Last date of online application is 08.01.2021, 17:00 hrs. Last date for receipt of online application printout alongwith supporting documents is 15.01.2021. Subsequent addendum / corrigendum in connection with the advertisement shall be posted in the University website only.

Sd/- Registrar

NSDL National Securities Depository Limited

National Securities Depository Limited (NSDL), one of the largest Depositories in the world, invites applications from exceptional leaders for the post of Managing Director & Chief Executive Officer (MD&CEO) to take the organization to greater heights.

Required experience:

- 20+ years of experience in the financial services industry, of which, last 5+ years should be at Leadership / Board level;
- Exposure to managing diverse stakeholder including regulators, investors, business partners, customers, employees;
- Demonstrable track record and ability to lead a market infrastructure institution and ensure efficient and secure operations of the capital markets;
- Market savvy leader with an entrepreneurial approach and an innovative bent of mind to drive business in a regulated ecosystem;
- Understanding of technology and ability to leverage the same for advancement of Indian capital markets;
- Familiarity with relevant regulatory requirements and track record of strict adherence to compliance standards;
- Ability to develop, grow and nurture a highly motivated and result oriented team;
- High sense of integrity; strong communication skills; a persuasive and passionate communicator.

Key responsibilities:

- Work with the Governing Board to establish and execute a sustainable, practical and realistic strategic direction (medium and long term) for NSDL and its subsidiaries;
- Identify business development & growth opportunities within the regulatory framework and drive implementation by creating the right partnerships, expanding into the right product segments;
- Ensure compliance to all the internal, regulatory and statutory norms during operations, product and business development to mitigate potential risks and revenue losses;
- Develop organization and workforce which is capable, performance oriented, motivated and sensitive to NSDL's culture and values.

Education: A Chartered Accountant or an MBA or equivalent qualification will be preferred.

Location: The position is based in Mumbai, India.

As per the SEBI (DSE) Regulations, 2018, a person may be appointed as Managing Director for a maximum of two terms not exceeding five years each subject to maximum age limit of 65 years. Maximum age as on 1st June 2021: 55 Years. The qualifying criteria may be relaxed for deserving candidates.

Interested candidates (Indian passport holders only) may send their CVs via email to mdceo.depositary@nsdl.co.in and online Application Form, please visit Company website: www.nsdl.co.in

Last date for Application: 29th December 2020, 6:00 pm IST. All applications will be held in strict confidence.

Final selection will be at the sole discretion of NSDL and the decision will be binding.

Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013, Tel: +91 22 2496 4200
CIN: U7120MH2012PLC230380, Website: www.nsdl.co.in

NPCI Bharat BillPay Limited

National Payments Corporation of India (NPCI) is the umbrella organization for all retail payment systems in India, set up with the guidance and support of the Reserve Bank of India (RBI) and Indian Banks' Association.

Bharat Bill Payment system, is a Reserve Bank of India (RBI) conceptualized ecosystem driven by NPCI. It is a one-stop ecosystem for all payments providing an interoperable and accessible 'anytime anywhere' payment service to all customers across India with certainty, reliability and safety of transactions.

NPCI is looking to onboard a senior leader who will lead the to be formed organization, NPCI Bharat BillPay Limited, through its next stage of evolution.

CHIEF EXECUTIVE OFFICER, NPCI BHARAT BILLPAY LIMITED

Required experience:

- Indian passport holder with minimum 15 years of experience in the financial services / e-commerce sector, with at least 5 years in leadership roles. Experience in digital payments desirable.
- Good understanding of the payment industry and associated technology infrastructure and concepts. Knowledge of cutting-edge technology and global advancements will be preferred.
- Familiarity with regulatory requirements and compliance standards in the payments industry.
- Proven experience in growing and scaling businesses / product lines preferred.
- Adept in managing and balancing the interest of multiple stakeholders as well as the ability to build strong relationships across internal and external stakeholders.
- Ability to develop, grow and nurture a highly motivated and result oriented team.
- Hands-on style of leadership with a high sense of integrity; strong communication skills; a persuasive and passionate communicator.

Key responsibilities:

- Formulate business growth strategies to engage and establish products through strategic alliances aimed at growing the top-line in a sustainable manner.
- Lead product and business development by driving strategic planning and developing implementation strategies.
- Develop strategies to drive productivity & efficiency across the organization while driving profitability and ensuring seamless availability of services.
- Ensure compliance to all the internal, regulatory and statutory norms during operations, products, and business development to mitigate potential risks and revenue losses.
- Develop organization and workforce which is capable, performance oriented, motivated and sensitive to NPCI's overall culture and values

Education: A Post-Graduate MBA (International Business / Marketing / Business Management) from a premier institute or similar will be preferred.

The position is based in Mumbai, India. Maximum Age as on January 01, 2021: 50 Years.

Interested candidates may send their CVs via email to ceo-bbps@npciferry.com OR in hard copy in a closed cover (marked Confidential - CEO, NPCI Bharat BillPay Limited) to: Korn Ferry International, UMI Estate, Tower A, 21st Floor, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai, India.

Last date for Application: 28th December 2020, 6:00 pm IST

All applications will be held in strict confidence. Age and experience limits may be relaxed for deserving candidates at the discretion of the Selection Committee and their decision will be final.

